



# ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ

“રાજીવ ગાંધી ભવન” સંસ્કાર કેન્દ્ર માર્ગ, વી.એસ. હોસ્પિટલ પાસે, એલિસબ્રીજ, અમદાવાદ-૩૮૦૦૦૬.  
ફોન : ૦૭૯-૨૬૫૭૮૨૧૨-૨૧૩, ૨૬૫૭૮૧૬૧, ૨૬૫૭૮૩૧૧ ફેક્સ : ૦૭૯-૨૬૫૭૮૫૮૮

Web : [www.incgujarat.com](http://www.incgujarat.com)

E-mail : [gpc1234@gmail.com](mailto:gpc1234@gmail.com)

અખબારી યાદી

તા. ૯-૨-૨૦૨૩

- ભાજપ શાસનનાં છેલ્લા ૬ વર્ષમાં એસસી-એસટી પર ૯૭૧૨ જેટલી ઘટનાઓ-હુમલાઓ
- ભાજપ સરકારમાં દર ૪૮ કલાકે અનુસુચિત જનજાતી પર ‘એક’ અત્યાચાર-હુમલા ઘટના: એસસી-એસટી પર સતત વધી રહેલા હુમલા રોકવામાં ભાજપ સરકાર નાકામ.
- ગુજરાતમાં એસટી એટ્રોસિટીના બનાવોમાં છેલ્લા ત્રણ વર્ષનો કન્વિક્શન રેટ એક ટકા કરતા પણ ઓછો: છેલ્લા ત્રણ વર્ષમાં એસટી એટ્રોસિટી કેસમાં માત્ર ૭ લોકોને સજા થઈ છે

અનુસુચિત જાતી(SC) અને અનુસુચિત જનજાતિ(ST) પરના અત્યાચારમાં થઈ રહેલા વધારા, પગલા ભરવામાં નાકામ ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તાશ્રી હિરેન બેન્કરએ જણાવ્યું હતું કે, લોકસભાના પટલ પર રજુ થયેલ ચોકાવનારા આંકડા પ્રમાણે ગુજરાતમાં એસસી-એસટી પર વધતી જતી એટ્રોસિટીની ઘટનાઓએ ગુજરાત માટે ચિંતાજનક બાબત છે. એસસી-એસટીના બંધારણીય હક્કો-અધિકારો અંગે ભાજપ સરકાર અનદેખી કરી રહી છે. ગુજરાતમાં અનુસુચિત જનજાતિ(ST) પર વર્ષ ૨૦૧૮માં ૩૨૧ કેસ રજીસ્ટર જ્યારે સજા માત્ર ૭ને થઈ. વર્ષ ૨૦૨૦-૨૮૧ જેટલા કેસ રજીસ્ટર જ્યારે સજા માત્ર ૨ને થઈ અને વર્ષ ૨૦૨૧માં ૩૪૧ જેટલા એટ્રોસિટીના કેસ રજીસ્ટર થયા પરંતુ એક પણને સજા થઈ નહિ. એટલે કે છેલ્લા ત્રણ વર્ષમાં એસટી એટ્રોસિટી કેસમાં માત્ર ૭ લોકોને સજા થઈ છે. એસટી એટ્રોસિટીના બનાવોમાં ગુજરાતમાં છેલ્લા ત્રણ વર્ષનો કન્વિક્શન રેટ એક ટકા કરતા પણ ઓછો છે. ભાજપ સરકારના રાજમાં છેલ્લા ત્રણ વર્ષમાં અનુસુચિતજનજાતી પર ૯૫૩ જેટલી એટ્રોસિટીની ગંભીર ઘટનાઓ થઈ છે આ નોંધાયેલી ઘટનાઓ છે જ્યારે ફરીયાદ ન લેવામાં આવે, ધમકાવીને કાઢી મુકવામાં આવે, ડર-ભય પેદા કરવામાં આવે જેનાથી ભોગ બનનાર ફરિયાદી ન બને જેવી ન નોંધાયેલી ઘટનાઓ બમણાથી પણ વધુ છે.

ભાજપ સરકારમાં દર ૪૮ કલાકે અનુસુચિત જનજાતી પર ‘એક’ અત્યાચાર-હુમલા ઘટના થાય છે. છેલ્લા ૬ વર્ષમાં એસસી-એસટી પર ૯૭૧૨ જેટલી ઘટનાઓ-હુમલાઓ થયા છે. એસસી-એસટી પરના થઈ રહેલા હુમલા સમગ્ર રાજ્ય માટે ચિંતાજનક બાબત છે. એસસી-એસટી પર સતત વધી રહેલા હુમલા રોકવામાં ભાજપ સરકાર નાકામ રહી છે. એસસી-એસટીના હક્કો-અધિકારો મળવા, કાયદાકીય બાબતો અંગે જાગૃતતા લાવવા છેલ્લા ૩ વર્ષમાં સમગ્ર દેશમાં ૧૫૦૦૦થી વધુ જનજાગૃતિના કાર્યક્રમો થયા પરંતુ ગુજરાતની ભાજપ સરકારએ વર્ષ ૨૦૧૮ અને ૨૦૧૯માં દેખાવ પૂરતા માત્ર ૬- ૬ અને વર્ષ ૨૦૨૦માં જાગૃતિ અંગેના એક પણ કાર્યક્રમ કર્યો નહિ. જે ભાજપ સરકારની એસી-એસટી વિરોધી માનસિકતા દર્શાવે છે.

અનુસુચિત જનજાતી પર એટ્રોસિટીની ઘટનાઓ			
ક્રમ	વર્ષ	કેસ નોંધાયા	દોષિતને સજા
૧	૨૦૧૮	૩૨૧	૭
૨	૨૦૨૦	૨૮૧	૨
૩	૨૦૨૧	૩૪૧	૦
કુલ		૯૫૩	૯

હિરેન બેન્કર

પ્રવક્તા